

રાજકોટ મહાનગરપાલિકા - આરોગ્ય શાખા - મેલેરિયા વિભાગ



સ્વચ્છ
સર્વેક્ષણ
૨૦૨૨

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ

ડૉ. આંબેડકરભાવન રૂમ નં. ૬, ત્રીજો માળ, બસ સ્ટેન્ડની પાસે,
દેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૨.

☎ : 0281 - 2237062

✉ : biologist_rmc@yahoo.in

👍 Like us on Facebook : /malaria.department

તા.૨૬/૦૮/૨૦૨૨

-: અખબાર યાદી :-

રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૧૯/૮/૨૦૨૨ થી તા.૨૫/૮/૨૦૨૨) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી
ડેન્ડ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અપનાવવું.

ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ છુટક છુટક વરસાદ હાલ ચાલુ જ છે. વરસાદની ઋતુ દરમ્યાન મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ડ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ડ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પત્તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ડ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

મચ્છર જન્ય રોગો	અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા (તા.૧૯/૮/૨૦૨૨ થી તા.૨૫/૮/૨૦૨૨)	વર્ષમાં કુલ નોંધાયેલ
મેલેરિયા	૨	૩૦
ડેન્ડ્યુ	૧૭	૧૦૪
ચિકુનગુનિયા	૨	૧૮

અન્ય રોગચાળાની કેસની વિગત

(તા.૧૯/૮/૨૦૨૨ થી તા.૨૫/૮/૨૦૨૨)

ક્રમ	વિગત	કેસની સંખ્યા
૧	શરદી - ઉધરસના કેસ	૨૫૩
૨	સામાન્ય તાવના કેસ	૪૯
૩	ઝાડા - ઉલટીના કેસ	૮૭
૪	ટાઈફોઈડ તાવના કેસ	૦
૫	કમળો તાવના કેસ	૦
૬	મરડાના કેસ	૦

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૯/૯/૨૦૨૨ થી તા.૨૫/૦૯/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૯૦,૨૫૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૧૨૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ધનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ નવાગામ પડ ન્યું શકિત સોસા. ૧ થી ૧૨, નવાગામ આવાસ યોજના, લાલપરી હનુમાન વાળી શેરી, નવાગામ વોકળા કાંઠો, લાલપરી મફતીયું, શીવનગર, મણીનગર, શ્રીનગર, વાલ્કેશ્વર, ગીતાંજલી સોસા., 'બિલ્મા હાઉસ" સરકારી કવા. ની આસપાસનો વિસ્તાર, અવંતિ પાર્ક, શિતલ પાર્ક, સિધ્ધી વિનાયક સોસા., શ્રી અમૃત પાર્ક શેરી નં. ૧ થી ૬ તથા મેઇન રોડ, ડેકોરા હિલ્સ એ થી ૯ વીંગ તથા મેઇન રોડ, કોસ્મોપ્લેસ ની પાછળ પેરેડાઇઝ હોલ તથા મુંજકાનો આસપાસનો વિસ્તાર, શ્રી ગાર્ડન વિંગ એ થી એચ તથા મેઇન રોડ, જીવરાજ પાર્ક, તિરૂપ્તતી કોમ્પ્લેક્ષ મેઇન રોડ તથા આસપાસનો વિસ્તાર, પંચવટી ટાઉનશીપ, લક્ષ્મણ પાર્ક શેરી નં. ૧ થી ૩, તુલસી પાર્ક, મીરા પાર્ક, ગોકુલધામ સોસા., ગુરુદેવ પાર્ક મે. રોડ, અંબિકા રેસીડેન્સી ૧ થી ૨ મે. રોડ, ગુરુદેવ પાર્ક - ૧ આખુ, વુંદાવન પાર્ક - ૧ થી ૩, નરસિંહ મહેતા ટાઉનશીપ, જયશકિત પાર્ક - ૧ થી ૨, ૫૦ ફુટ મે. રોડ, અંબીકા પાર્ક - ૧ થી ૨, ચિંતન પાર્ક ૮૦ ફુટ રોડ, જુનો મોરબી રોડ, ગાંધી વસાહત સોસા., સતાધાર પાર્ક શેરી નં. ૧ થી ૫ તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, રૈયારામ પાર્ક શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ, શાંતીનિકેતન પાર્ક શેરી નં. ૧ થી ૫ તથા મેઇન રોડ તથા આજુબાજુના વિસ્તાર તથા નંદનવન આવાસ યોજના શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ, અમી રેસીડેન્સી (રેલનગર), પરસાણાનગર, ધ્વારકેશન રેસીડેન્સી (રેલનગર), સખીયાનગર, શિવધામ સોસા., રાધામીરા ઇન્ડ. એરીયા, મીરા ઉદ્યોગ, સંસ્કાર ઇન્ડ. એરીયા, મધુવન ઇન્ડ. એરીયા, શ્રી હરી ઇન્ડ. એરીયા, આજી જી.આઇ.ડી.સી., ભોમેશ્વર સોસા., ઋષીકેશ પાર્ક, રણજાનગર, ગોકુલનગર, સંતોષીનગર, કૃષ્ણનગર, રઘુનંદન સોસા., પોપટપરા, સ્વમી વિવેકાનંદનગર (૫૩ કવા.), પોપટપરા પોલીસ લાઇન, ધનશ્યામ વાટીકા, ધનશ્યામ રેસીડેન્સી, મુરલીધર સોસા., વિજયનગર શેરી નં. ૧ થી ૫ મેઇન રોડ, ગ્રીન પાર્ક શેરી નં. ૧ થી ૨, વિનોદનગર આવાસ, વિનોદનગર શેરી નં. ૧ થી ૫ મેઇન રોડ, પારસ સોસા. શેરી નં. ૧ થી ૩, માઘવ રેસીડેન્સી સોસા. ૧ થી ૨, અમરાતીતનગર સોસા. - ૧ થી ૨, વડવાળાનગરનું મફતીયાપરા, શીવમ પાર્ક - ૧ થી ૨, ઓસ્કાર સ્કાય પાર્ક, કરણપરા શેરી નં. ૧૧, ૧૨ તથા આસપાસનો વિસ્તાર, ચંદ્રશેખર આઝાદ પ્રા. શાળા નં. ૬૨, ભગવતી સોસા. - ૧ થી ૫, ગંજીવાડા મહાકાળી ચોકી, ગંજીવાડા મે. રોડ, લાખાજીરાજ સોસા. - ૧ થી ૭, ફાડૂકી સોસા. - ૧ થી ૫, હેદરી ચોક, શાળા નં. ૬૬ પાસેનો ગંજીવાડા વિસ્તાર, જગદિશનગર, મધર ટેરેસા આશ્રમ પાસેનો વિસ્તાર, ગુલશન પાર્ક, દુધસાગર મે. રોડ, કૃષ્ણનગર, ગાંધી સોસા., સત્યમ સોસા., સુંદરમ સોસા., શિવમ સોસા., બ્રાહમણીયાપરા - ૧ થી ૬ મે. રોડ, ચંપકનગર - ૧ થી ૫, શીંગાળા પ્લોટ - ૧/૨, ભીમા લુણાગરીયાની શેરી, શ્રી રણછોડનગર, સદગુરૂનગર ભાગ - ૧, શકિત સોસા., - ૧ થી ૧૪, સિલ્વર નેસ્ટ - ૧ થી ૩, કબીરવન સોસા. - ૧ થી ૩, મેહુલનગર - ૧ થી ૩, કનકનગર - ૧ થી ૧૦, સંજયનગર - ૧ થી ૪, મહેશનગર, ૧/૨, સીતારામ સોસા. - ૧ થી ૩, અંબિકા સોસા. મે. રોડ, ગાયત્રીધામ સોસા., ગાયત્રીધામ, બજરંગવાડી, રેલનગર - ૩ વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેબ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી

રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પત્તિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૩૬ પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પત્તિ સબબ ૭૮૭ આસામીને નોટીસ આપવામાં આવેલ છે.

ડેબ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અપનાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યક્તિઓ સુધી પહોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનીટ આપને તેમજ આપના પરિવારને ડેબ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

ખાસ કરીને ડેબ્યુ મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ.

- અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ
- અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
- પક્ષીકુંજ, પશુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વપરાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખવા બાદ જ સવારે નવું પાણી ભરવું.
- અગાસી, છાપરા વગેરે પર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
- પીવાના તથા ઘરવપરાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાયુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ.
- ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ.

યાદ રાખો...

આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુક્ત રાજકોટ

આરોગ્ય અધિકારી
રાજકોટ મહાનગરપાલિકા